



**Second Year B. A. (Sem. IV) (CBCS) Examination**

**March/April – 2018**

**Statistical Methods : Paper - IV**

*(Elective-II) (New Course)*

**Faculty Code : 001**

**Subject Code : 0014133**

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70]

- સૂચના :** (૧) દરેક પ્રેશનના ગુણ સરખા છે.  
 (૨) બધા જ પ્રેશનો ફરજિયાત છે.

- ૧ ઉત્પાદન પ્રક્રિયા માટેની નિયંત્રણની સીમાઓ સમજાવો. સાનુકમનો સિદ્ધાંત      ૧૪  
 સમજાવો.

**અથવા**

- ૧ S.Q.C. સંવિસ્તર સમજાવો. ઉત્પાદન પ્રક્રિયામાં જોવા મળતા ચલનના વિવિધ      ૧૪  
 કારણો સમજાવો.

- ૨ ચલનાત્મક આલેખો અને ગુણાત્મક આલેખો વચ્ચેનો તફાવત સમજાવો.      ૧૪  
 $\bar{X}$  આલેખની રચના સમજાવો.

**અથવા**

- ૨ નીચે આપેલ માહિતી પરથી  $\bar{X}$  અને  $R$  આલેખની રચના કરી, ઉત્પાદન      ૧૪  
 પ્રક્રિયા અંગેનો નિર્ણય જણાવો. એક નિર્દર્શમાં ચાર અવલોકનો છે.  
 ( $n = 4$  માટે  $A_2 = 0.73$ ,  $D_3 = 0$ ,  $D_4 = 2.28$  )

$\bar{X}$	40	39	41	39	40	38	43	40	41	37
$R$	12	6	4	6	14	10	6	8	8	4

- 3 P આલેખની રચના સમજાવો. નીચેની માહિતી માટે P આલેખની રચના કરો. 14  
દરેક નિર્ધરણમાં 100 વસ્તુઓ તપાસેલ છે.

ક્રમ	1	2	3	4	5	6	7	8	9	10
ખામીવાળી વસ્તુ	12	10	6	8	9	9	7	10	11	8

### અથવા

- 3 nP આલેખની રચના તેની નિયંત્રણ સીમાઓ સાથે ઉદાહરણ સહિત સમજાવો. 14  
4 સ્વીકૃતિ નિર્ધરણ યોજના અને એક નિર્ધરણ સ્વીકૃતિ યોજના ઉદાહરણ સહિત સમજાવો. 14

### અથવા

- 4 C-આલેખ એટલે શું ? સમજાવો. C આલેખની નિયંત્રણ સીમાઓ લખો. 14  
નીચેની માહિતી પરથી C-આલેખની રચના કરો અને ઉત્પાદન પ્રક્રિયા અંગેનો તમારો નિર્ણય જણાવો :  
ખામીવાળી વસ્તુની સંખ્યા : 12, 08, 16, 14, 10, 06, 02, 09, 12.
- 4 ગમે તે બે પ્રશ્નોના જવાબ આપો : 14  
(1) પદો સમજાવો : LTPD, AOQ.  
(2) R આલેખની રચના.  
(3) સાંઘિકીય ગુણવત્તા નિયંત્રણ (S.Q.C.)ની ઉપયોગિતાઓ.  
(4) એક નિર્ધરણ સ્વીકૃત યોજના (100, 10, 1) માટે ખામીપ્રમાણ 6% હોય ત્યારે AOQ અને ATI શોધો.

## ENGLISH VERSION

**Instructions :** (1) All questions carry equal marks.  
(2) All questions are compulsory.

- 1 Explain control limits for the production process. 14  
Also explain the theory of runs principle.  
**OR**  
1 Explain S.Q.C. and causes of variation in production process. 14

- 2** Explain the difference between variable charts and attributes charts and also explain the construction method for  $\bar{X}$  charts. **14**

**OR**

- 2** From the given data, prepare  $\bar{X}$  and  $R$  chartes and give the decision about production process. Each sample contains four observations.  
 $(n = 4, A_2 = 0.73, D_3 = 0, D_4 = 2.28)$  **14**

$\bar{X}$	40	39	41	39	40	38	43	40	41	37
$R$	12	6	4	6	14	10	6	8	8	4

- 3** Explain construction of  $P$  chart and for the given data, prepare  $P$  chart. There are 100 items inspected in each sample. **14**

Nos.	1	2	3	4	5	6	7	8	9	10
Def. items	12	10	6	8	9	9	7	10	11	8

**OR**

- 3** Explain the construction of  $nP$  chart with its control limits and also with illustration. **14**
- 4** Explain : Acceptance sampling plan and Single sampling plan with illustration. **14**

**OR**

- 4** Explain C chart with its control limits. For the given data prepare C chart and give your decision about production process. **14**

No. of def. items : 12, 08, 16, 14, 10, 06, 02, 09, 12

- 5** Answer any two questions : **14**
- (1) Explain : LTPD and AOQ.
  - (2) Construction of R chart - explain.
  - (3) Importance of S.Q.C.
  - (4) For the Single sampling plan (100, 10, 1) if proportion defective is 6%, then obtain the value of AOQ and ATI.
-